

પ્રકરણ-૩ (નિયમ સંગ્રહ-૨)

અધિકારીઓ અને
કર્મચારીઓની સત્તા અને ફરજો

અનુક્રમ	હોદ્દો	વહીવટી સત્તા	નાણાંકીય સત્તા	ફરજો	અન્ય
૧	૨	૩	૪	૫	૬
૩.૧	કાર્યપાલક ઈજનેર	<p>૧) પ્રોજેક્ટનીદરખાસ કરવી.</p> <p>૨) ૨૫૦૦૦/- રૂ. સુધીનાં ખર્ચનાં મેઈન્ટનાન્સ કામોની મંજુરી આપવી.</p> <p>૩) રહેણાકી તેમજ બીન રહેણાકીય યુનીટનાં ડ્રેનેજ કનેક્શનની મંજુરી આપવી.</p> <p>૪) પ્રાઇવેટ સફાઈ માટે ઘોરણસર ચાર્જ વસુલી કામગીરી માટે મંજુરી આપવી.</p> <p>૫) વિભાગની તાંત્રીક તેમજ વહીવટી કામગીરી માટે સંબંધીત કર્મચારી અધિકારીને લેખિત તેમજ મૈબિક સુચના આપી કામગીરી કરાવવી.</p>	<p>રૂ. ૨૫,૦૦૦/- ની મર્યાદા મહત્વમાટે માસીક રૂ. ૫,૦૦,૦૦૦/-</p> <p>રૂ. ૫૦૦/- મેન્યુઅલી ડ્રેનેજ સફાઈ ચાર્જ.</p>	<p>૧) વિભાગીય કામગીરી માટે સંબંધીત કર્મચારી/અધિકારીની કામગીરી, ફરજો નિયત કરવી.</p> <p>૨) વિભાગીય કામગીરી માટે મહાનગરપાલિકા યોજાતી બેઠકમાં મીટીંગ હાજરી આપવી તેમજ ઉપરી અધિકારીને જરૂરી માહિતી પુરી પાડવી.</p> <p>૩) વિભાગનાં કર્મચારી-અધિકારી પર તાંત્રીક તેમજ બિનતાંકી કામગીરી માટે સીધું નિયંત્રણ રાખવું.</p> <p>૪) શહેરની ડ્રેનેજ વિભાગનાં કામો અંગે પ્રોજેક્ટ તૈયાર કરાવવા તેની દરખાસ્ત મંજુર થયેથી તેનું અમલીકરણ કરાવવું.</p> <p>૫) વિભાગનાં કામોની ટેકનીકલ સ્થળ મુલાકાત લઈ, થયેલ કામાનાં બીલ તૈયાર કરાવવા.</p> <p>૬) વિભાગનાં કર્મચારીનાં સ્ટાફ એસ્ટ્રાબ્લીશમેન્ટની તમામ કામગીરીનું નિયંત્રણ.</p> <p>૭) ઉપરી અધિકારી ધ્વારા સોંપવામાં આવે તેવી કામગીરી.</p>	<p>વિભાગીય સ્ટાફ પર સીધું નિયંત્રણ.</p>
૩.૨	નાયબ કાર્યપાલક ઈજનેર (સીવીલ.)	૧) વિભાગની તાંત્રીક તેમજ વહીવટી કામગીરી માટે નીચેનાં સ્ટાફને લેખિત તેમજ મૈબિક સુચનાં આપી કામગીરી કરાવવી.	--	<p>૧) વિભાગની કામગીરીને લગત મોટા તેમજ નાના કામો માટે દરખાસ્તો તૈયાર કરાવવી. મંજુરી અર્થે રજુ કરવી.</p> <p>૨) મંજુર રહેલ દરખાસ્તનાં ટેન્ડરો જાહેરાત, તૈયાર કરાવવી.</p> <p>૩) ચાલુ કામોની સ્થળ મુલાકાત લેવા.</p> <p>૪) રનીંગ બીલો તેમજ ફાયનલ બીલો તૈયાર કરાવવા</p>	<p>૧) સ્થળ પર ચાલતાં મેઈન્ટનાન્સનાં કામોમાં સીધો નિર્ણય લઈ ફરીયાદ નિકાલની કામગીરી.</p> <p>૨) આઉટડોર તથા ઈન્ડોર સ્ટાફની હાજરી ચકાસી ઉપરી અધિકારીને સિપોર્ટિંગ</p>

				<p>તથા સર્વની કામગીરી પર નિયંત્રણ.</p> <p>૫) બિનતાંત્રીક કર્મચારીની કામગીરીનું વહીવટી સંચાલન કરવું.</p> <p>૬) જાહેર પદ્ધીક તરફથી આવતી ફરિયાદનાં નિકાલ માટેનાં વ્યવસ્થા તંત્રનું સંચાલન.</p> <p>૭) સરકારી, તેમજ અર્ધસરકારી વિભાગો ધ્વારા માંગવામાં આવતી તેમજ મીટિંગને લગત માહીતી અહેવાલ તૈયાર કરાવવી રજુ કરવો.</p> <p>૮) શહેરનાં ડેવલપમેન્ટ ને લગતાં કામો અંગે જરૂરી સવે કરાવી દરખાસ્ત ઉપલ્બિ સત્તાને રજુ કરવી.</p> <p>૯) ઉપરી અધિકારી ધ્વારા સૌંપવામાં આવતી અન્ય કામગીરી.</p>	કરવાની સત્તા.
૩.૩	નાયબ કાર્યપાલક ઈજનેર (મીકે.)	૧) શહેરમાં ટ્રેનેજ વિભાગમાં આવેલ તમામ પંપીગ સ્ટશનો જાહેર W/C ઉપરના પંપ સેટ્સ ડીજી સેટ્સ, જેટીગ મશીનો સહિતના તમામ વાહનો તથા ટ્રેનેજ સ્ટોર સંબંધિત કામગીરી. પ્રાઈવેટ વર્ડીનું નિયત્રણની કામગીરી.	પ્રાઈવેટ વર્ડીના રૂ. ૬૮૦/- ફી કલાક/એક ફેશના ભરાવવાની સત્તા.	<p>૧) જેટીગ મશીન, ડીજી સેટ તથા ટ્રેનેજ વિભાગના અન્ય વાહનો ની રીપેરીગ/મેઇન્ટેનાન્સ તથા અપગ્રેડેશનની કામગીરી.</p> <p>૨) પંપીગ સ્ટેશનોનું મેઇન્ટેનાન્સ/રીપેરીગ તથા તંત્રનું અપગ્રેડેશનની કામગીરી.</p>	
૩.૪	મદદનીશ ઈજનેર	–	–	<p>૧) વોર્ડવાઈઝ ટ્રેનેજ સફાઈને લગતી ફરિયાદોન નિકાલની કામગીરી.</p> <p>૨) કેપીટલ તથા પરચ્યુરણ કામોની સ્થળ મુલાકાત લેવી, અંદાજ તૈયાર કરવા, કોન્ટ્રાધ્વારા કામો કાવવા, તેના માપો લેવા, બીલ બનાવી રજુ કરવા.</p> <p>૩) પ્રોજેક્ટ અંગેનાં લેવલ સર્વે કરાવવા ગ્રેડ નક્કી કરવા, ડીઝાઈન રિપોર્ટ તૈયાર કરવા અને તે અંગેની દરખાસ્તો રજુ કરવી.</p> <p>૪) જાહેર યુરીનલ તથા બાથરૂમનાં પ્રપોઝ તેમજ હયાત યુનિટોની જરૂરી કામગીરીના અંદાજો તૈયાર કરી રજુ કરવા.</p> <p>૫) પે-એન્ડ યુઝ સીસ્ટમ તથા જાહેર સંસ્થાઓ તરફથી આપવામાં આવતાં ફંડ અંગેનો અહેવાલ તૈયાર કરી જરૂરી અંદાજો રજુ કરવા.</p>	<p>૧) કેપીટલ તેમજ મેઇન્ટેનાન્સનાં કામો સ્પેશીઝીકેશન મુજબ કરાવવા જરૂરી સુચના આપવાની સત્તા.</p> <p>૨) નિયત્રણ હેઠળનાં સ્ટાફની હાજરી ચેક કરી રિપોર્ટ કરવાની સત્તા.</p>

				<p>૬) વાર્ષિક ભાવો, રેઈટ એનાલીસીસ, એક્સેસ, સેવીગપત્રકો જરૂરીયાત મુજબ તૈયાર કરી રજૂ કરવા.</p> <p>૭) લાયસન્સ પદ્મરોણાં લાયસન્સો રીન્યુ કરવા માટેની દરખાસ્તો રજૂ કરવી.</p> <p>૮) ડ્રેનેજ કનેક્શન તથા લે-આઉટ મંજુરીની નિયમઅનુસાર ચકાસણી કરી રીપોર્ટ રજૂ કરવા. ૯) નિયંત્રણ હેઠળનાં કર્મચારીઓ પાસેથી નિયત કામગીરી લેવી તેમજ તેનાં રિપોર્ટ મેળવવા.</p> <p>૧૦) ઉપરી અધિકારી ધ્વારા સોંપવામાં આવતી કામગીરી કરવી, તેમજ કરાવવી.</p>	
૩.૫	અધિક મદદનીશ ઇજનેર	-	-	<p>૧) વોર્ડવાઈઝ ડ્રેનેજ સફાઈને લગતી ફરીયાદોનાં નિકાલની કામગીરી.</p> <p>૨) કેપીટલ તથા પરચુરણ કામોની સ્થળ મુલાકાત લેવી, અંદાજ તૈયાર કરવા, કોન્ટ્રા.ધ્વારા કામો કાવવા, તેના માપો લેવા,બીલ બનાવી રજૂ કરવા.</p> <p>૩) પ્રોજેક્ટ અંગેનાં લેવલ સર્વે કરાવવા ગ્રેડ નક્કી કરવા,ડીઝાઈન રિપોર્ટ તૈયાર કરવા અને તે અંગેની દરખાસ્તો રજૂ કરવી.</p> <p>૪) જાહેર યુરીનલ તથા બાથરુમનાં પ્રપોઝ તેમજ હ્યાત યુનિટોની જરૂરી કામગીરીના અંદાજો તૈયાર કરી રજૂ કરવા.</p> <p>૫) પે-એન્ડ યુઝ સીસ્ટમ તથા જાહેર સંસ્થાઓ તરફથી આપવામાં આવતાં ફેંડ અંગેનો અહેવાલ તૈયાર કરી જરૂરી અંદાજો રજૂ કરવા.</p> <p>૬)વાર્ષિક ભાવો, રેઈટ એનાલીસીસ, એક્સેસ, સેવીગ પત્રકો જરૂરીયાત મુજબ તૈયાર કરી રજૂ કરવા.</p> <p>૭)લાયસન્સ પદ્મરોણાં લાયસન્સો રીન્યુ કરવા માટેની દરખાસ્તો રજૂ કરવી.</p> <p>૮) ડ્રેનેજ કનેક્શન તથા લે-આઉટ મંજુરીની નિયમઅનુસાર ચકાસણી કરી રીપોર્ટ રજૂ કરવા.</p> <p>૯) નિયંત્રણ હેઠળનાં કર્મચારીઓ પાસેથી નિયત કામગીરી લેવી તેમજ તેનાં રિપોર્ટ મેળવવા.</p> <p>૧૦) ઉપરી અધિકારી ધ્વારા સોંપવામાં આવતી</p>	<p>૧) સ્થળ પર ચાલતાં મેઇન્ટેનાન્સનાં કામોમાં સીધો નિર્ણય લઈ ફરીયાદ નિકાલની કામગીરી.</p> <p>૨) આઉટડોર તથા ઇન્ડોર સ્ટાફની હાજરી ચકાસી ઉપરી અધિકારીને રિપોર્ટિંગ કરવાની સત્તા.</p>

				કામગીરી કરવી, તેમજ કરાવવી.	
૩.૬	સીની. સબ. ઈન્સ.	-	-	<p>૧) દરેક વોર્ડમાં જઈ વર્ધી ચેક કરવી.</p> <p>(૨) વોર્ડ ઈન્સ.ને ડ્રેનેજ લાઈન ફરિયાદ અંગે સુચના આપી કામગીરી કરાવવી.</p> <p>(૩) દરેક વોર્ડનાં રજા રજીસ્ટર અને હાજરી મસ્ટર ચેક કરવા.</p> <p>(૪) દરેક વોર્ડના જાહેર ડબલ્યુ.સી. અને યુરીનલ સફાઈની ચેકીંગ કામગીરી.</p> <p>(૫) વોર્ડમાં ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણ અંગે નોટીસ આપી કાર્યવાહી કરવી.</p>	<p>દરેક વોર્ડની હાજરી મસ્ટરરજા-રજીસ્ટર-વોર્ડની કામગીરીમાં સ.ઈ.ઉપર દેખરેખ સ.કા.ની ફેરબદલી કરવી જેટીંગ મશીનની કામગીરીમા આવેલ ફરિયાદો નિકાલ અંગેની દેખરેખ.</p>
૩.૭	વોર્ડ સબ. - ઈન્સ્પેક્ટર	-	-	<p>૧) વોર્ડના દરેક સ.કા.ની હાજરી અને રજા રજીસ્ટર તૈયાર કવા.</p> <p>૨) વોર્ડની આવેલ ફરિયાદો અંગે સફાઈ કામદારો તથા વાહનોની વર્ધીકરી ફરીયાદોના નિકાલ અંગે રોજેરોજ કામગીરી પુરી કરાવવી.</p> <p>(૩) જાહેર ડબલ્યુ.સી. યુરીનલ સફાઈ કામગીરી.</p> <p>(૪) વોર્ડની સ્ટ્રોમ લાઈન ડ્રેનેજ લાઈનો સાફ કરાવવી.</p>	<p>વોર્ડમાં આવતી ડ્રેનેજ ફરિયાદોનો નિકાલ સ.કા.ની હાજરી રજા રજીસ્ટર ખતવણી સીની. ઈન્સ. અ.મ.ઈ.ની સુચના પ્રમાણેની કામગીરી.</p>
૩.૮	વોર્ડ મુકાદમ	-	-	વોર્ડમાં ઈન્સ.તરફથી મળેલ સુચના મુજબ ડ્રેનેજ લાઈન જાળીયા જાહેર ડબલ્યુ.સી. યુરીનલ સફાઈની કામગીરી સ.કા. કામદાર પાસેથી કરાવવી.	<p>વોર્ડના સ.કા. ઉપર વર્ધીની કામગીરી નિકાલ કરવો તેમજ વોર્ડ ઈન્સ.તરફથી મળેલ સુચના મુજબની કામગીરી ડ્રેનેજ લાઈન સ્ટોર્મ લાઈન સાફ કરવાની કામગીરી.</p>
૩.૯	સફાઈ કામદાર	-	-	વોર્ડની ડ્રેનેજ લાઈનો સ્ટોર્મ લાઈન વરસાથી જાળીયા ઉત્ભરાતી ગટર લાઈનો જાહેર ડબલ્યુ.સી. યુરીનલ સફાઈની કામગીરી.	<p>વોર્ડમાં આવતી ફરિયાદમાં ડ્રેનેજ લાઈન સફાઈ સ્ટ્રોમ લાઈન સફાઈ કરવી. જાહેર યુરીનલ જાહેર ડબલ્યુ. સી. સફાઈ કરવાની કામગીરી.</p>